

Bilateral meeting of External Affairs Minister with Winston Peters, Deputy Prime Minister and Foreign Minister of New Zealand

February 26, 2020

ન્યૂઝીલેન્ડનાં નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સ સાથે વિદેશ મંત્રીની દ્વિવપક્ષીય મીટિંગ

ફેબ્રુઆરી 26, 2020

ન્યૂઝીલેન્ડનાં નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મહામહિમ શ્રી વિન્સ્ટન પીટર્સ સાથે વ્યાપાર મંત્રી શ્રી ડેવિડ પાર્કર અને વ્યાપાર પ્રતિનિધિમંડળ 25-28 ફેબ્રુઆરી, 2020 નાં રોજ ભારતની મુલાકાત લઈ રહ્યા છે.

ન્યૂઝીલેન્ડનાં નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી 26 ફેબ્રુઆરી, 2020 નાં રોજ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી અને દ્વિવપક્ષીય સંબંધોની સ્થિતિની સમીક્ષા કરી હતી અને રાજકીય, આર્થિક, સંરક્ષણ, સુરક્ષા અને લોકો સાથે લોકોનાં સંબંધો વધારે પ્રબળ બનાવવા અંગેના પગલાઓની ચર્ચા કરી હતી.

આ મીટિંગ પછી હૈદરાબાદ હાઉસ પર રાત્રી ભોજન રાખવામાં આવ્યું હતું, જેમાં વ્યાપાર મંત્રી પીટર્સ જોડાયા હતા જેઓ પણ માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલને 26 ફેબ્રુઆરી, 2020 નાં રોજ મળ્યા હતા. મંત્રી શ્રી પાર્કર પણ માનનીય નાણામંત્રી શ્રીમતિ નિર્મળા સિતારમણને 26 ફેબ્રુઆરી, 2020 નાં રોજ મળ્યા હતા.

નાયબ વડાપ્રધાન પીટર્સ પર્યાવરણ, નવ અને આબોહવામાં ફેરફાર માટેનાં માનનીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર સાથે 27 ફેબ્રુઆરી, 2020 નાં રોજ મુલાકાત કરશે. ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિમંડળ મુંબઈની મુલાકાત લેશે અને ભારતીય ઉદ્યોગો સાથે પણ આદાન-પ્રદાન કરશે.

પોતાની ભારતની મુલાકાત પહેલા, ન્યૂઝીલેન્ડનાં નાયબ વડાપ્રધાને નવું વ્યૂહાત્મક પેપર “ઈન્ડિયા 2025-ઈન્વેસ્ટિંગ ઇન ધ રીલેશનશિપ” રીલીઝ કર્યું હતું, જે એનએ ઇન્ક. ઇન્ડિયા સ્ટ્રેટેજી 2011 સાથે સાતત્યમાં છે. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આ પેપર દ્વિવપક્ષીય જોડાણો, પારસ્પરિક એકસમાન ધ્યેય મજબૂત કરવા માટેની મનોકામના પ્રતિબિંબિત કરે છે. ભારતે સૌર ઊર્જા અને આબોહવાનાં પગલામાં સહકાર આપવા માટે ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિએટિવ (આઈપીઓઆઈ) અને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (આઈએસએ) માટે ન્યૂઝીલેન્ડ દ્વારા પ્રદાન કરવામાં આવેલા સમર્થન બદલ તેનો આભાર માન્યો હતો.

બન્ને પક્ષોએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેઓનાં સંબંધિત અભિગમો પર દ્રષ્ટિકોણોની આપ-લે કરી હતી; અને પૂર્વ એશિયાઈ શિખર સંમેલન અને સંબંધિત મંચમાં સાથે મળીને કામ કરવા પર સંમત થયા હતા. તેઓએ

स्वायत्तता, अधिकार क्षेत्रनी अप्ठंडितता अने आ प्रांतमां शांति अने स्थिरता माटे युअेनसीअेलओअेस सलित आंतरराष्ट्रीय कानूननो आदर करवानी अगत्यता पर भार मूक्यो હતો. तेओ अे बाअत साथे पाणु संमत थया હતા કે स्थिर આंतरરાષ્ટ્રીય વ્યાપાર પર્યાવરણ અતિ મહત્વપૂર્ણ છે અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં રચનાત્મક રીતે જોડાવા સંમત થયા હતા. ન્યૂઝીલેન્ડો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનાં કાયમી સભ્યપદ માટે સમર્થન મોકલ્યું હતું.

ન્યૂઝીલેન્ડમાં વધતા ભારતીયો અને વિદ્યાર્થીઓ બન્ને રાષ્ટ્રો વચ્ચે એક મજબૂત જોડાણ સર્જે છે, જે બન્ને દેશો વચ્ચે ગાઢ સંબંધ સ્થાપિત કરવામાં સકારાત્મક યોગદાન આપે છે.

નવી દિલ્હી
ફેબ્રુઆરી 26, 2020

DISCLAIMER : This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.